

# ગ્રામ્ય વિસ્તાર માટે કાયદાકીય સંહિતા (કન્ટ્રીસાઇડ કોડ)



ઉદ્યાનો અને જળમાર્ગો, દરિયાકાંઠો અને ગ્રામ્ય  
વિસ્તારની મજા માણવા માટે તમારી માર્ગદર્શિકા

## અનુક્રમણિકા

[દરેકનો આદર કરો >>](#)

[પર્યાવરણનું રક્ષણ કરો >>](#)

[આઉટડોર્સમાં આનંદ માણો >>](#)

[ગ્રામ્ય વિસ્તારોના પ્રતીકો અને ચિહ્નો જાણો >>](#)

# દરેકનો આદર કરો



- ગ્રામ્ય વિસ્તારમાં રહેતા, કામ કરતા અને આ વિસ્તારનો આનંદ માણતા લોકો માટે વિચારશીલ બનો
- પ્રવેશદ્વાર અને મિલકત તમે જોયેલી સ્થિતિમાં છોડો
- પાર્કિંગ કરતી વખતે પ્રવેશદ્વારો અથવા વાહનમાર્ગોની પહોંચને અવરોધિત કરશો નહીં
- માયાળુ બનો, હેલો કહો, જગ્યાનો વહીંચીને ઉપયોગ કરો
- સ્થાનિક ચિહ્નો અનુસરો અને બહોળી પહોંચ ઉપલબ્ધ ન હોય ત્યાં સુધી ચિહ્નિત માર્ગોને વળગી રહો

## ખેતી, પશુધન અને જંગલી પ્રાણીઓ

તમારી ક્રિયાઓ અન્ય લોકોના જીવન અને આજીવિકાને અસર કરી શકે છે.

ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતા લોકો સાથે સહકાર સાધો. ઉદાહરણ તરીકે, પ્રાણીઓની હેરફેર થતી હોય અથવા પ્રાણીઓ એકત્રિત કરવામાં આવે ત્યારે ખેડૂતની દોરવણીને અનુસરો. આનાથી દરેકને સુરક્ષિત રાખવામાં મદદ મળે છે.

પ્રવેશદ્વાર અને મિલકત તમે જોયેલી સ્થિતિમાં છોડો અથવા ચિહ્નો પરની સૂચનાને અનુસરો. સમૂહમાં હો ત્યારે, છેલ્લી વ્યક્તિ પ્રવેશદ્વાર કેવો છોડીને જવું તે જાણતી હોવાની ખાતરી કરો. પશુઓને અંદર રાખવા અથવા ખોરાક અને પાણી મળે તે માટે ખુલ્લા છોડવા ખેડૂતો દરવાજા બંધ રાખે છે. ફાર્મ મશીનરી, ઘોડા અથવા પશુધન સાથે દખલગીરી ન કરો. જો તમને લાગે કે ખેતરનું પ્રાણી સંતાપિત છે, તો ખેડૂતને ચેતવવાનો પ્રયત્ન કરો.

જંગલી પ્રાણીઓ, પશુધન અને ઘોડાને પુષ્કળ જગ્યા આપો. તેઓની વર્તણૂક અણધારી બની શકે છે, ખાસ કરીને જ્યારે તેઓ પોતાના બચ્ચાં સાથે હોય અને તમને નુકસાન થઈ શકતું હોય.

પશુધન, ઘોડા અથવા જંગલી પ્રાણીઓને ખવડાવશો નહિ કારણ કે તે તેઓને નુકસાન કરી શકે છે.

## ગ્રામ્ય પ્રવાસ અને પાર્કિંગ

ગ્રામ્ય માર્ગો પરનો વાહનવ્યવહાર લોકો અને વન્યપ્રાણીઓ માટે જોખમી બની શકે છે.

ગ્રામ્ય માર્ગો પર ડ્રાઇવિંગ કરતી વખતે વાહન ધીમું અને કાળજીપૂર્વક ચલાવો. પાર્કિંગ કરતી વખતે ખાતરી કરો કે તમે પ્રવેશદ્વાર અથવા વાહનમાર્ગોની પહોંચને અવરોધિત કરતા નથી. હંમેશા કટોકટી વાહનોની અવરજવર માટે પ્રવેશ ખુલ્લો રાખો.

ઘરની બહાર મુલાકાત લેતી વખતે તમારી કાર ઘરે રાખવાનું વિચારો. તેના બદલે તમે જાહેર પરિવહનનો ઉપયોગ કરી શકશો. [Traveline website](#) પર જાહેર પરિવહનને લગતી માહિતી મેળવો.

વધારાની કાળજી રાખો અને સચેત રહો જ્યાં માર્ગ પરથી રેલ્વે લાઇન પસાર થતી હોય. તમે લેવલ ક્રોસિંગ્સનો સુરક્ષિત રીતે ઉપયોગ કરવા [Network Rail](#) વેબસાઇટ પર માર્ગદર્શન મેળવી શકો છો.

સામેથી આવતા વાહનવ્યવહારથી સાવધ રહો અને [The Highway Code](#) અનુસરો જ્યારે તમે પેવમેન્ટ (ફૂટપાથ) વગરના રસ્તા પર ચાલતા હો.

## માયાળુ બનો, હેલો કહો, જગ્યાનો વહીંચીને ઉપયોગ કરો

તમે ઘરની બહાર સમય વિતાવતા હો ત્યારે તમારી સામે અન્ય વપરાશકર્તાઓ અને પ્રાણીઓ આવી શકે છે. ડ્રાઇવિંગ કરતા સમયે અથવા સાયકલ ચલાવતી વખતે ઘોડા, પદયાત્રીઓ અને પશુધન માટે વાહન ધીમું ચલાવો અથવા થોભી જાવ. હંમેશાં તેઓને અવરજવર માટે પુષ્કળ જગ્યા આપો.

સાઇકલ સવારોએ બ્રાઇડલવેઝ (ઘોડામાર્ગ) પર પદયાત્રીઓ અને ઘોડેસવારોને માર્ગ આપવો રહ્યો.

સાયકલ સવારો અને ઘોડેસવારોએ પદયાત્રીઓની સુરક્ષાનો આદર કરવો જોઈએ, પરંતુ પદયાત્રીઓએ પણ તેઓને અવરોધવા નહિ અથવા જોખમમાં મૂકવા નહીં.

## સ્થાનિક ચિહ્નો અનુસરો અને બહોળી પહોંચ ઉપલબ્ધ ન હોય ત્યાં સુધી ચિહ્નિત માર્ગોને વળગી રહો

તમે તમારો માર્ગ શોધવામાં સહાય માટે નકશા અને સ્થાનિક ચિહ્નોનો ઉપયોગ કરો. ચિહ્નિત માર્ગો કાદવવાળા હોય તો પણ તે માર્ગ પર રહો, સિવાય કે બહોળી પહોંચ ઉપલબ્ધ હોય, જેમ કે ખુલ્લી જમીનની પહોંચ. આ પાક અને વન્યપ્રાણીઓને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય છે.

ગ્રામ્ય વિસ્તારમાં વપરાતાં [ચિહ્નો અને પ્રતીકો](#) જાણો. તેઓ તમને ગ્રામ્ય વિસ્તારમાં જુદા જુદા વપરાશકર્તાઓ માટેના રૂટ્સ ઓળખવામાં સહાય કરે છે.

ખેતરની સીમાઓમાં તમે દરવાજા, પગથિયાં અથવા અવરજવરની જગ્યાનો ઉપયોગ કરો જ્યાં તમે તેમ કરી શકો. સીમાઓ પર ચડવું નુકસાન પહોંચાડી શકે છે અને પશુધનને જોખમમાં મૂકી શકે છે.

જો તમને લાગે કે નિશાની ગેરકાયદેસર કે ગેરમાર્ગે દોરે છે તો [સ્થાનિક સત્તાવાળા](#)નો સંપર્ક કરો. ઉદાહરણ તરીકે, જાહેર ફૂટપાથ પર 'ખાનગી - પ્રવેશ નહીં' ચિહ્ન.

# પર્યાવરણનું રક્ષણ કરો



- તમારો ગંદવાડો ઘરે લઈ જાવ - તમારી મુલાકાતની કોઈ નિશાની ન છોડો
- આગ લગાડો નહિ અને બારબેક્યુસનો ઉપયોગ માત્ર ત્યાં કરો જ્યાં ચિહ્નો તમને તે કરી શકતા હોવાનું કહે
- તમારા ફૂતરાઓને હંમેશાં નિયંત્રણમાં અને તમારી નજરમાં રાખો
- ફૂતરાનું મળ - તેને બેગમાં ભરો અને તેને કોઈ જાહેર કચરાના ડબ્બામાં નાખો
- કુદરતની સંભાળ લેવી - નુકસાન અથવા ખલેલ પહોંચાડશો નહીં

વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે આપણાં ગ્રામ્ય વિસ્તારની અને ખુલ્લી જગ્યાઓનું રક્ષણ કરવાની આપણાં સૌની જવાબદારી છે.

કુદરતની સંભાળ લેવી - નુકસાન અથવા ખલેલ પહોંચાડશો નહીં. ખડકો, પથ્થર, છોડ અને ઝાડ તમે જોયેલી સ્થિતિમાં છોડો અને જમીન પર માળો મૂકતા પક્ષીઓ સહિતના વન્યપ્રાણીઓને ખલેલ ન પહોંચાડવાની કાળજી રાખશો.

ખંડેર અથવા ઐતિહાસિક સ્થળોને અડચણરૂપ ન બનો - કુદરતી અને હયાત પર્યાવરણનો આપણો વારસો મહત્વપૂર્ણ છે.

## તમારો ગંદવાડો ઘરે લઈ જાવ - તમારી મુલાકાતની કોઈ નિશાની ન છોડો

તમારી સાથે બેગ લાવવાનું યાદ રાખો અને તમારો કચરો અને વઘેલા ખાદ્ય પદાર્થનો કચરો ઘરે લઈ જાવ, જાહેર કચરાપેટીનો ઉપયોગ કરો અથવા શક્ય હોય તો રિસાયકલ કરો. ગંદવાડો ગ્રામ્ય વિસ્તારનું સૌંદર્ય બગાડે છે અને વન્યપ્રાણી અને પશુધન માટે જોખમી બની શકે છે. ગંદવાડો ફેંકવો અને કચરો નાખવો એ ફોજદારી ગુનો બને છે.

## આગ લગાડો નહિ અને બારબેક્યુસનો ઉપયોગ માત્ર ત્યાં કરો જ્યાં ચિહ્નો તમને તે કરી શકતા હોવાનું કહે

ખુલ્લી જવાળાઓ અને સિગારેટથી સચેત રહો. બારબેક્યુસનો ઉપયોગ માત્ર ત્યાં કરો જ્યાં ચિહ્નો તમને તે કરી શકતા હોવાનું જણાવે. તમારું બારબેક્યુ હંમેશાં ઘરની બહાર રાખો, રાખ ઠંડી હોવાની અને જવાબદારીપૂર્વક તેનો નિકાલ કરવાની ખાતરી કરો. આગ લોકો અને મિલકત માટે જેટલી જોખમી હોય છે તેટલી જ તે વન્યપ્રાણીઓ અને નિવાસસ્થાનો માટે વિનાશક બની શકે છે.

કેટલાક જમીન સંચાલકો વનસ્પતિ ઉછેર માટે નિયંત્રિત આગનો ઉપયોગ, ખાસ કરીને ખરાબો અને વેરાન જમીન પર 1 ઓક્ટોબરથી 15 એપ્રિલ વચ્ચે કરતા હોય છે. 999 પર કોલ કરો જો તમને કોઈની દેખરેખ વગરની આગ દેખાય.

## તમારા ફૂતરાઓને હંમેશાં નિયંત્રણમાં અને તમારી નજરમાં રાખો

ગ્રામ્ય વિસ્તારો, ઉદ્યાનો અને દરિયાકિનારો તમારા ફૂતરાને કસરત કરાવવા લઈ જવા માટેની શ્રેષ્ઠ જગ્યાઓ છે પરંતુ તમારે અન્ય વપરાશકર્તાઓ અને વન્યપ્રાણીઓને ધ્યાનમાં લેવાની જરૂર છે.

તમારો ફૂતરો વન્યજીવન, પશુધન, ઘોડા અને અન્ય લોકોથી દૂર

હોવાની ખાતરી કરવા તેને અસરકારક નિયંત્રણમાં રાખો સિવાય કે નિમંત્રણથી લઈને આવ્યા હો. તમારે આ કરવું જોઈએ:

- તમારા ફૂતરાને હંમેશાં આગળ અથવા તમારી નજરમાં રાખવો
- દૃઢ વિશ્વાસ રાખો કે તમારો ફૂતરો તમારા બોલાવવા પર પાછો આવશે
- ખાતરી કરો કે તમને પ્રવેશવાનો અધિકાર હોય તે માર્ગ અથવા વિસ્તારથી તમારો ફૂતરો ભટકી ન જાય

સ્થાનિક ચિહ્નો હંમેશાં તપાસો કારણ કે એવી પરિસ્થિતિઓ ઊભી થતી હોય છે જ્યારે તમારે તમારા ફૂતરાને આખું કે આંશિક વર્ષ માટે આગળ રાખવું અનિવાર્ય હોય. સહાયક ફૂતરા સિવાય સ્થાનિક વિસ્તારો પણ ફૂતરા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી શકે. આ સ્થાનિક પ્રતિબંધો તમને ચિહ્નો જણાવશે.

તમે ગમે ત્યાં હો તમારા ફૂતરાને પશુધનથી આગળ રાખો તે સારી પ્રથા છે.

ખુલ્લી પહોંચ આપતી જમીન પર અને દરિયાકિનારે, તમારે તમારા ફૂતરાને પશુધનથી આગળ રાખવા રહ્યાં. 1 માર્ચથી 31 જુલાઈની વચ્ચે, તમારે તમારા ફૂતરાને ખુલ્લી પહોંચ આપતી જમીન પર આગળ રાખવા રહ્યાં, પછી તે જમીન પર કોઈ પશુધન ભલે ન હોય. આ કાનૂની આવશ્યકતાઓ છે.

પશુધન પર હુમલો કરતા અથવા તેનો પીછો કરતા ફૂતરા પર ખેડૂત ગોળી ચલાવી શકે છે. તેઓ ફૂતરાના માલિકને વળતર આપવાને જવાબદાર ન બને તેવું બની શકે.

જો પશુધન અથવા ઘોડાથી તમને ભય હોવાનું તમને લાગે, તો તમારા ફૂતરાને આગળ ન રાખો તે ચાલે. તમારા ફૂતરાને સુરક્ષિત રાખવામાં તમને ઇજા થવાનું જોખમ ન લો. તમારા ફૂતરાને છુટ્ટો રાખવાથી તમે બંને માટે સુરક્ષિત રહેવાનું સરળ બનશે.

આ [ડોગ વોર્કિંગ કોડ](#) તમને વધુ માહિતી આપી શકે છે.

## ફૂતરાનું મળ - તેને બેગમાં ભરો અને તેને કોઈ જાહેર કચરાના ડબ્બામાં નાખો

તમારા ફૂતરાના મળવાળી જગ્યાને હંમેશાં સાફ કરો કારણ કે તે લોકો, પશુધન અને વન્યજીવનમાં બીમારીનું કારણ બની શકે છે.

ફૂતરાના મળની બેગ આસપાસ ક્યારેય છોડશો નહિ, પછી ભલે તેને પાછળથી લઈ જવાની તમારી તૈયારી હોય. ડિઝોડરાઇઝ્ડ બેગ્સ અને કન્ટેનર્સ ફૂતરાના મળવાળી બેગ લઈ જવાનું સરળ બનાવી શકે છે. જો તમે જાહેર કચરાપેટી ન શોધી શકો, તો તમારે બેગ ઘરે લઈ જવી જોઈએ અને તમારી પોતાની કચરાપેટીનો ઉપયોગ કરવો જોઈએ.

# આઉટડોર્સમાં આનંદ માણો

- તમારો માર્ગ અને સ્થાનિક પરિસ્થિતિઓ તપાસો
- તમારા સાહસનું આયોજન કરો - શેની અપેક્ષા રાખવી અને તમે શું કરી શકો છો તે જાણો
- તમારી મુલાકાતનો માણો, મજા કરો, યાદગાર બનાવો



બહાર ફરવું તમારી સુખાકારી માટે ઉત્તમ છે. તે આરામ, શાંતિ અને પ્રવૃત્તિ માટેનું સ્થાન છે. તમને ઘરની બહાર કરવા ગમતી પ્રવૃત્તિમાં, તમે તેનો વધુ આનંદ માણશો જો તમે પહેલેથી તૈયારી કરો.

## તમારો માર્ગ અને સ્થાનિક પરિસ્થિતિઓ તપાસો

તમે તમારો માર્ગ જાણતા હોવાની અને તમને જોઈતા નકશાઓ તમારી પાસે હોવાની ખાતરી કરો. તમે બહાર નીકળો તે પહેલાં અદ્યતન નકશા, માર્ગદર્શિકાઓ વાંચો અથવા વેબસાઇટ્સ જુઓ.

તમે આઉટડોર્સ મનોરંજન જૂથોની નિષ્ણાત પ્રવૃત્તિઓ વિશે સલાહ ખોળી શકો છો. [Getoutside](#) અથવા [Visit Britain](#) જેવી વેબસાઇટ્સ આ જૂથોની યાદી પૂરી પાડી શકે છે. માહિતી કેન્દ્રો તમને સ્થાનિક વિચારો અને સલાહ પણ આપી શકે છે.

## હવામાન, ભરતી અને પાણીની સ્થિતિઓ તપાસો

તમે પ્રસ્થાન કરતા પહેલાં હવામાનની આગાહી તપાસો. પર્વતો અને દરિયાકિનારે પરિસ્થિતિઓ ઝડપથી બદલાઈ શકે છે. તમે બહાર અને ક્યાંક નજીકમાં હો ત્યારે સ્થિતિઓ બદલાઈ જાય તો પાછાં ફરતા ડરશો નહીં.

તમે ઘરની બહાર જતા પહેલાં [ભરતીનો સમય](#) તપાસવાથી ભરતી વધવાની સાથે ફસાવાનું જોખમ ઘટાડી શકશો. માત્ર સમુદ્ર જ નહિ, કેટલીક નદીઓ પણ ભરતીમાં ફેરફારથી પ્રભાવિત થાય છે. લપસવાના કારક પહાડો અને દરિયાઈ ઘાસ પર કાળજી રાખો.

તમે પાણીમાં પેડલિંગ, તરવા અથવા આનંદ માણવા ઇચ્છતા હો તો પાણીની ગુણવત્તા અને સ્થિતિઓ માટે [પર્યાવરણ સંસ્થાની વેબસાઇટ](#) તપાસો.

## તમારા સાહસનું આયોજન કરો - શેની અપેક્ષા રાખવી અને તમે શું કરી શકો છો તે જાણો

તમે ક્યાં જઈ રહ્યા છો અને ક્યારે તમે પાછા આવવા ધારો છો તે અન્ય લોકોને જણાવો. ગ્રામ્ય વિસ્તારોમાં કલાકો સુધી તમને કોઈ જોવા ના મળે અને ફોનના સિગ્નલ્સ ઘણાં સ્થળોએ નબળાં હોય છે.

તમે તમારી પોતાની અને તમારી સંભાળમાં રહેલા અન્ય લોકોની સુરક્ષા માટે જવાબદાર રહો છો. ખાતરી કરો કે તમારી પ્રવૃત્તિ માટે તમને જરૂરી આવડતો અને જ્ઞાન તમે ધરાવો છો.

સુરક્ષિત રહેવા, હવામાનમાં ફેરફારો સહિતના કુદરતી જોખમોનો સામનો કરવા તૈયાર રહો. ખાતરી કરો કે તમે તમારી આયોજિત પ્રવૃત્તિઓ માટે યોગ્ય કપડાં અને સાધનો સાથે લો.

જો સ્થાનો વ્યસ્ત હોય તો તમારે તમારા આયોજનો બદલવાની જરૂર પડે તેવા કિસ્સામાં લચીલા રહો.

## અધિકાર અને પરવાનગી

આ કોડ જુદા જુદા વપરાશકર્તાઓના અધિકારો વિશેની માહિતી નિર્ધારિત કરે છે. કેટલીક પ્રવૃત્તિઓ માટે તમને જમીનમાલિકની પરવાનગી લેવાની જરૂર પડી શકે, જેમાં નીચેની પ્રવૃત્તિઓ સામેલ છે:

- કેમ્પિંગ
- તાજા પાણીમાં તરવું
- તાજા પાણીમાં માછીમારી કરવી

તમારી મુલાકાતનો આનંદ માણો, મજા કરો, મુલાકાત યાદગાર બનાવો

# ગ્રામ્ય વિસ્તારોના પ્રતીકો અને ચિહ્નો જાણો

ગ્રામ્ય વિસ્તારોમાં ઉપયોગમાં લેવાતા ચિહ્નોમાં સામેલ છે:



## પીળા રંગનું તીર



## વાદળી રંગનું તીર



## જાંબલી રંગનું તીર




## લાલ રંગનું તીર - તમામ ટ્રાફિક માટે ખુલ્લો પેટામાર્ગ (બાયવે ઓપન ટૂ ઓલ ટ્રાફિક - BOAT)



## નેશનલ ટ્રેઇલ

ચાલવા માટે બનાવાય છે, જેમાં કેટલાક રસ્તાઓ પર ઘોડેસવારી અને સાયકલ સવારી શક્ય છે. મર્યાદિત ચલાયમાનતા ધરાવતાં વપરાશકર્તાઓ ટ્રેઇલની અનુકૂળતા ચકાસવા [National Trail](#) વેબસાઇટ જોઈ શકે છે. આ વેબસાઇટમાં નકશા, ટ્રિપ પ્લાનિંગ ટૂલ્સ અને ટ્રેઇલ ડાયવર્ઝન પર માહિતી પણ સામેલ છે. આ પ્રતીક ઇંગ્લેન્ડ કોસ્ટ પાથ સહિતના ઇંગ્લેન્ડ અને વેલ્સના લાંબા અંતરનાં 16 માર્ગોને ચિહ્નિત કરે છે.



## પહાડો પર ચાલતી વ્યક્તિવાળું ગોળાકાર બ્રાઉન પ્રતીક

ઓપન એક્સેસ સાઇન, તમે માર્ગોથી દૂર ફરી કરી શકો છો. આમાં નીચેના ઘણાં ક્ષેત્રો સામેલ છે:

- પર્વત
- મૂરલેન્ડ (એક પ્રકારની ખુલ્લી જમીન)
- આરોગ્ય
- તળેટી
- દરિયાકાંઠાનો વિસ્તાર
- નોંધાયેલી સામાન્ય જમીન



નકશા, માહિતી અને કોઈપણ પ્રવેશ પ્રતિબંધો માટે [Open Access website](#) તપાસો.

## કોઈ પોસ્ટ કે ગેટ પર સ્થાનિક ચિહ્ન - પરવાનગી આપતો માર્ગ

સ્થાનિક ચિહ્નો પરની સલાહ અનુસરો કારણ કે જમીનમાલિકો સ્વેચ્છાએ આ માર્ગો પર પહોંચ પૂરી પાડે છે અને તેઓ તેનો ઉપયોગ કોણ કરી શકે છે તે પસંદ કરે છે. કેટલાક ખુલ્લાં પ્રવેશ ક્ષેત્રો પણ તે જ રીતે ઉપલબ્ધ કરવામાં આવે છે.

